

સૂચના : (1) બધા જ વિભાગ તથા પ્રશ્નો ફરજિયાત છે. (2) જમણી બાજુના આંકડા પ્રશ્નોના કુલ ગુણ દર્શાવે છે.
(3) પ્રશ્નપત્ર ધ્યાનથી વાંચી નિયત સમયમાં પૂર્ણ કરો. (4) પ્રશ્નપત્રમાં ક્યાંય પણ જવાબ કે નિશાની કરવી નહીં.

વિભાગ - A

- નીચેના પ્રશ્નો માટે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો : (પ્રત્યેકનો 1 ગુણ) (10)
- હિસાબી પદ્ધતિની મર્યાદા કઈ છે ?
(A) નફાકારકતા જણાવે છે. (B) આર્થિક સ્થિતિ જણાવે છે.
(C) કરવેરા આયોજન દર્શાવે છે. (D) નાણાનું સ્થિર મૂલ્ય
 - માલની ઉધાર ખરીદી થાય ત્યારે....
(A) મિલકત વધે - દેવું વધે. (B) મિલકત ઘટે - દેવું ઘટે.
(C) મિલકત વધે - દેવું ઘટે. (D) મિલકત ઘટે - દેવું વધે.
 - એ આમનોંધ અને રોકડ ખાતાની ગરજ સારે છે.
(A) રોકડમેળ (B) વેચાણનોંધ (C) વેચાણ-પરત નોંધ (D) લેણીહૂંડી નોંધ
 - અન્ય પેટાનોંધોમાં ન નોંધાતા હોય તેવા વધેહારો કયા ચોપડામાં નોંધાય છે ?
(A) આમનોંધ (B) ખાસ આમનોંધ (C) રોકડમેળ (D) અન્ય નોંધ
 - બેન્ક સિલકમેળ દ્વારા તૈયાર કરવામાં આવે છે.
(A) બેન્ક (B) વેપારી (C) બેન્ક અને વેપારી બંને (D) ઓડિટર
 - નીચેનામાંથી કોનો સમાવેશ પેટાનોંધમાં થતો નથી ?
(A) વેચાણનોંધ (B) પેટા-રોકડમેળ (C) ખાતાવહી (D) ઉધારનોંધ
 - રોકડમેળ મુજબ બેન્કસિલક એટલે બાકી.
(A) ઉધાર (B) જમા (C) ઉધાર અને જમા (D) ઉધાર અથવા જમા
 - ઊભું કરવું ધંધા માટે યોગ્ય નથી.
(A) સામાન્ય અનામત (B) જોગવાઈ (C) ગુપ્ત અનામત (D) મૂડી અનામત
 - દેશીનામામાં રકમ લખતી વખતે રૂપિયા અને પૈસાની રકમ વચ્ચે 'r'ની નિશાની કરાય છે, તેને શું કહે છે ?
(A) આવરો (B) ઓળાચો (C) ઉતારો (D) ફાકું-મારવું.
 - ICAI દ્વારા ASBની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી ?
(A) 1977 (B) 1877 (C) 1978 (D) 1878

વિભાગ - B

- નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો : (પ્રત્યેકનો 1 ગુણ) (05)
- ખાતાનાં પ્રકાર જણાવો.
 - GSTનું પૂરું નામ આપો.
 - ખાતાને કેટલી બાજુ હોય છે ? કઈ કઈ ?
 - અનામતના પ્રકારો જણાવો.
 - કયા ખ્યાલ મુજબ દર વર્ષે સ્ટોક મૂલ્યાંકનની પદ્ધતિ બદલવી ન જોઈએ ? દા સરિઅમ કિતો ખર્ચ છે ?

વિભાગ - C

- નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ બે પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો : (પ્રત્યેકના 3 ગુણ) (06)
- નીચે આપેલા વ્યવહારો પરથી શ્રી મોહનકુમારના ચોપડામાં ખરીદનોંધ તૈયાર કરો :
2024
માર્ચ 1 ₹ 10,000નો માલ પુજા પાસેથી એક માસની ^{શાખ} ~~છાજ~~ પર ખરીદ્યો.
2 નમ્રતાને ₹ 5,000નો માલ 10% વેપારી વટાવે મોકલી આપવા ઓર્ડર આપ્યો.
20 ઉપેન પાસેથી ₹ 36,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો અને અડધા નાણા તરત જ ચૂકવી આપ્ય
30 પ્યારેલાલ પાસેથી ₹ 3,000નો માલ ખરીદ્યો. બિલ. નં 10

17. નીચે આપેલ વિગતોના આધારે પ્રવિણ પટેલનું તા. 31-3-2024ના રોજનું કાર્ય સરવૈયું તૈયાર કરો :

ખાતાનું નામ	રકમ (₹)	ખાતાનું નામ	રકમ (₹)
શરૂઆતનો સ્ટોક	7,000	ખરીદી	30,000
મજૂરી	5,000	મળેલ વ્યાજ	7,000
વેચાણ	4,00,000	લેણદારો	50,000
સમારકામ	8,000	વીજળી ખર્ચ	10,000
બેન્ક લોન	28,000	ઘાલખાધ	15,000
જમીન-મકાન	5,00,000	મૂડી	90,000

18. શ્રી જીવરામભાઈના તા. 31-3-2024ના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબો તૈયાર કરતાં પહેલાં શોધવામાં આવેલ નીચેની ભૂલો સુધારવા ભૂલસુધારણા નોંધ તૈયાર કરો :

- (1) ₹ 50,000ના ખરીદેલ માલની નોંધ કરવાની રહી ગઈ છે.
- (2) યંત્ર ખરીદી તેને ગોઠવવાનો ખર્ચ ₹ 7,000 પરચૂરણ ખર્ચ ખાતે ઉધારેલ છે.
- (3) મીરાને ચૂકવેલ ₹ 4,000 ભૂલથી રાધા ખાતે નોંધ્યા છે.

વિભાગ - D

● નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ ત્રણ પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો : (પ્રત્યેકના 4 ગુણ)

(12)

19. નીચેના વ્યવહારો પરથી શ્રી પ્રામાણિક પટેલના ચોપડે આમનોંધ લખો.

2024

જુલાઈ 1 ₹ 5,000 રોકડા, ₹ 20,000ના દેવાદારો, ₹ 10,000ના માલસ્ટોક તથા ₹ 5,000ના લેણદારો લાવી ધંધો શરૂ કર્યો.

2 બેન્કમાં ₹ 2,000 રોકડા ભરી ખાતું ખોલાવ્યું.

3 માધુરી પાસેથી ₹ 1,000 ઘાલખાધ પરતના મળ્યા.

4. પુત્રના જિંદગીના વીમા પ્રીમિયમના ₹ 450 તથા આગના વીમા પ્રીમિયમના ₹ 500 ચેકથી ચૂકવ્યા.

20. વિક્રમાદિત્યનો રોકડમેળ તા. 31-03-2024ના રોજ બેન્ક ખાતાની જમા બાકી ₹ 12,000 દર્શાવે છે. નીચેની માહિતી પરથી તેમનો બેન્ક સિલકમેળ તૈયાર કરો :

- (1) તા. 30-03-2024ના રોજ બેન્કે જમા કરેલ વ્યાજના ₹ 160 રોકડમેળમાં નોંધાયા નથી.
- (2) બેન્કમાં ભરેલ પરંતુ રોકડમેળમાં નહીં નોંધેલ ચેક ₹ 8,000.
- (3) લખેલ અને બેન્કે ચૂકવેલ પરંતુ રોકડમેળમાં નહીં નોંધેલ ચેક ₹ 6,000.
- (4) રોકડમેળની આવ બાજુનો સરવાળો ભૂલથી ₹ 2,000 ઓછો ગણવામાં આવ્યો છે.

21. ઝલકે ₹ 72,000નો માલ પ્રતિક પાસેથી તા. 16-9-2024ના રોજ ખરીદ્યો. પ્રતિકે ₹ 72,000ની 3 માસની મુદતની હૂંડી ઝલક પર લખી અને ઝલકે હૂંડીનો સ્વીકાર કરી પ્રતિકને પરત કરી. આ વ્યવહારની નોંધ ઝલક અને પ્રતિકના ચોપડે કરો.

22. હૂંડી અને વચનચિઠ્ઠી વચ્ચેનો તફાવત સમજાવો.

વિભાગ - E

● નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્નનો માગ્યા મુજબ જવાબ આપો : (પ્રત્યેકના 6 ગુણ)

(06)

23. નીચેના વ્યવહારો પરથી શ્રી હરિશંદ્રના ચોપડામાં આમનોંધ લખી ખાતાવહીમાં જરૂરી ખાતાં ખોલી ખતવણી કરો :

2020

એપ્રિલ 1 ₹ 40,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો.

2 ₹ 18,000 બેન્કમાં ભર્યા.

8 ₹ 22,000 ઓફિસ ખર્ચ ચૂકવ્યો.

24. પરમ એન્ડ આનંદ કંપનીએ તા. 1-4-2022ના રોજ એક યંત્ર ₹ 1,10,000માં ખરીદ્યું. આ યંત્રને ગોઠવવાનો ખર્ચ ₹ 6,000 અને કારખાના સુધી લાવવાનો ખર્ચ ₹ 4,000 થયો. કંપની દર વર્ષે 8% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણે છે. તા. 31-3-2023ના રોજ આ યંત્ર તેની ચોપડે કિંમતના 20% નુકસાનથી વેચી દેવામાં આવ્યું. ત્રણેય વર્ષનું યંત્રખાતું તૈયાર કરો.

● નીચેના પ્રશ્નનો માગ્યા મુજબ જવાબ આપો :

(11)

25. શ્રી રૂક્મણીબેનનું તા. 31-3-2024ના રોજનું કાર્ય સરવૈયું અને વધારાની માહિતી પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો.

શ્રી રૂક્મણીબેનનું તા. 31-3-2024ના રોજનું કાર્ય સરવૈયું

ઉધાર બાકીઓ	રકમ (₹)	જમા બાકીઓ	રકમ (₹)
ઉપાડ ✓	12,000	મૂડી	4,00,000
ખરીદી ✓	6,00,000	વેચાણ	9,98,000
સ્ટોક (તા. 1-4-2023) ✓	60,000	ખરીદ પરત ✓	20,000
આવકમાલ ગાડાભાડું	10,000	મળેલ ડિબેચર વ્યાજ	10,000
વેચાણ પરત ✓	40,000	મળેલ વટાવ	4,000
પગાર	1,20,000	મળેલ કમિશન	2,000
મજૂરી ✓	40,000	10%ની બેન્ક લોન	2,00,000
ઓફિસ ખર્ચ	80,000	દેવીહૂડી	15,000
દેવાદારો	90,000	લેણદાર	70,000
લેણીહૂડી	30,000	ચૂકવવાનું બાકી ભાડું	1,000
જાહેરાત ખર્ચ	50,000		
સ્ટેશનરી-છપામણી	6,000		
યંત્રો	90,000		
મકાન	3,00,000		
ફર્નિચર	60,000		
ભાડું	12,000		
10%ના ડિબેચરમાં રોકાણ	1,00,000		
બેન્ક લોનનું વ્યાજ	20,000		
	17,20,000		17,20,000

હવાલાઓ :

- (1) આખરમાલનો સ્ટોક ₹ 1,10,000 છે.
- (2) નહીં નોંધેલ ઉધાર ખરીદી ₹ 40,000.
- (3) ચૂકવવાની બાકી મજૂરી ₹ 10,000.
- (4) ₹ 10,000નો માલ આગથી બળી ગયો, જેનો વીમા કંપનીએ પૂરેપૂરો દાવો મંજૂર કર્યો.
- (5) અંગત વપરાશ માટે લીધેલ માલ ₹ 5,000.

• • • • •